



**Bank of India**  
*Relationships beyond banking*

**Plot No. 315-316, Rambaugh Road,  
Ward-4/B, Adipur.**

**By Courier / Registered Post A/D****Date: 28.04.2025**

To,  
**Mr. Narayan Kishanchand Lalwani (Guarantor) Mobile: + 91 9825799339**  
**Add.:** Sadhu Vaswani Kunj-19, Rajiv Resort, Ward-6B, Adipur, Kutch

Sir,

You are aware that the Bank of India, Adipur Branch has sanctioned Home Loan facilities aggregating to an amount of **Rs. 48,00,000.00** to **Mrs. Kalpa Shanker Khushlani, Mr. Bharat Shanker Khushlani, Nilesh Shanker Khushlani, Mr. Shanker Motumal Khushlani (Principal Debtor/s)** for which you stood as guarantor and executed letter of guarantees dated 03.09.2020 guaranteeing the due repayment of the said amount by the Principal Debtor/s and all interest, cost, charges and expenses due and accruing thereon. The details of various credit facilities granted by the Bank and the amounts outstanding dues thereunder as on the date of notice are as under.

| Nature of Facility                         | Sanctioned Limit | Ledger Outstanding | Uncharged Int. | Total Outstanding |
|--------------------------------------------|------------------|--------------------|----------------|-------------------|
| Star Home Loan<br>A/c. No. 385175110000161 | Rs. 48,00,000.00 | Rs. 45,58,336.06   | Rs. 33,175.78  | Rs. 45,91,511.84  |

**2.** As the principal debtor has defaulted in repayment of his liabilities, we have classified his dues as **Non-Performing Asset on 30.03.2025 in accordance with the directions or guidelines issued by the Reserve Bank of India.**

**3.** As stated herein above, in view of the default committed by the principal debtor/s, you as the guarantor became liable jointly and severally for the said debt.

**4.** For the reasons stated above, we invoke your guarantee and call upon you to discharge in full your liabilities by paying to the Bank sum of **Rs. 45,91,511.84 (Rs. Forty Five Lakhs Ninety One Thousand Five Hundred Eleven and Paisea Eighty Four) with further interest thereon @ 8.75% p.a.** compounded with Monthly rests, within 60 days of receipt of this notice failing which we will be constrained to initiate legal action against you including by filing appropriate legal proceeding against you before Debts Recovery Tribunal/Court for recovery of the said amounts with applicable interest from the date of the notice till the date of actual realization along with all costs, expenses, etc. incidental thereto.

**Date: 28.04.2025. Place: Gandhidham****Authorised Officer, Bank of India**



**Aadhar Housing Finance Ltd.**

**Corporate Office:** Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.

**Vadodara Branch:** Office No.404, 4th Floor, Atlantis Complex, Opp. Petrol Pump, Sarabhai Road, Vadodara-390001 (Gujarat)

**Surendranagar Branch:** Shop No.327, 328 & 329, 3rd Floor, Mega Mall, Near Milan Cinema, S.T. Road, Surendranagar-363001 (Gujarat)

**Botad Branch:** Office No. 302, Royal Plaza, C.S.No.5561, sheet no:-76 Botad - 364710, (Gujarat)

**APPENDIX IV POSSESSION NOTICE (for immovable property)**

Whereas, the undersigned being the Authorized Officer of **Aadhar Housing Finance Limited (AHFL)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within **60 days** from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

| Sr. No. | Name of the Borrower(s)/ Co-Borrower(s) (Name of the Branch)                                                                                                                          | Description of Secured Asset (Immovable Property)                                                                                                                                                                                                                                                                | Demand Notice Date & Amount               | Date of Possession |
|---------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------------------|--------------------|
| 1       | (Loan Code No. 03810000236 / Vadodara Branch)<br>Ankitkumar Natavarbhai Patel (Borrower),<br>Pravinben Patel (Co-Borrower)                                                            | All that part & parcel of property bearing, GF FF CTS No 52 Ballyadev Temple Faliyu Mochi Bazar Padra Vadodara Gujarat 391440. <b>Boundaries:</b> East- Main Road, West- Somabhai Vadiyu House, North- Chunibhai House, South - Ramchandra bhai House                                                            | <b>10-02-2025 &amp;<br/>₹ 10,77,101/-</b> | <b>05-05-2025</b>  |
| 2       | (Loan Code No. 03710000963 / Surendranagar Branch)<br>Mukeshbhai Ramjiibhai Dharjiya (Borrower),<br>Kailashben Mukeshbhai Dharjiya (Co-Borrower)                                      | All that part & parcel of property bearing, Ground Floor 466 Ramdevji Mandir Raypar Road Haripar Gadhada Botad Gujarat 364750. <b>Boundaries:</b> East- House of Vallabhbhai Ramjiibhai, West- House of Dhanjibhai Chhaganbhai, North- Road and House of Sureshbhai Ramjiibhai, South - Land of Ramdevpir Temple | <b>10-02-2025 &amp;<br/>₹ 5,91,068/-</b>  | <b>03-05-2025</b>  |
| 3       | (Loan Code No. 32510000165 / Botad Branch)<br>Pravinbhai Rameshbhai Chekhaliya (Borrower),<br>Sunitaben Pravinbhai Chekhaliya (Co-Borrower)<br>Manilal Govardhan Zapadiya (Guarantor) | All that part & parcel of property bearing, GF And FF Unit No-02 Bapa Sitaramnagar Dhankaniya Road 153 Paiki North Side Land Botad Bhavnagar Gujarat 364001. <b>Boundaries:</b> East-6.00 Mtr Wide Road, West-Plot No-160, North- Plot No-152, South - Plot No-153 Paiki South Side Land                         | <b>10-02-2025 &amp;<br/>₹ 7,93,064/-</b>  | <b>03-05-2025</b>  |
| 4       | (Loan Code No. 32510000361 / Botad Branch)<br>Rameshbhai Karshanbhai Adaniya (Borrower),<br>Tinaben Rameshbhai Adaniya (Co-Borrower)                                                  | All that part & parcel of property bearing, G.F. Unit No-2 Radhe Krishna Nagar-3 Gadhada Road Botad 73 Paiki North Side Land Botad Botad Gujarat 364710 <b>Boundaries:</b> East-6.00 Mtr Wide Road, West-Plot No-68, North- Plot No-72, South- Plot No-73 Paiki South Side Land (Unit No-1)                      | <b>10-02-2025 &amp;<br/>₹ 7,12,419/-</b>  | <b>03-05-2025</b>  |

**Place : Gujarat****Date : 07-05-2025****Authorised Officer**  
**Aadhar Housing Finance Limited**

**E-AUCTION SALE NOTICE**  
**Dt . : 22.05.2025 | TIME 2.00 PM to 6.00 PM**

**Panar Branch, Anavil Street, Navsari - 396460**  
**Mo. 9328284429 | E-mail Id : panar@bankofbaroda.com**

**बैंक ऑफ बरौदा**  
**Bank of Baroda**

**Sale Notice For Sale Of Immovable Properties "APPENDIX- IV-A [See proviso to Rule 8 (6)]**

**E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.**

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on **"As is where is", "As is what is", and "Whatever there is"** basis for recovery of dues in below mentioned accounts/. The details of Borrower/s/Mortgagor/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below -

| Sr. No. | Name of Borrower/s /Guarantor/s/ Mortgagor/s                                                                                       | Description of Property                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         | Dues (In Rs.)                                      | Reserve Price (In Rs) of EMD (In Rs.) | Status of Possession | Property Visit Date                             |
|---------|------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------|---------------------------------------|----------------------|-------------------------------------------------|
| 1.      | Vinaykumar Babubhai Patel (Borrower cum Mortgagor)<br>Sureshbhai Narshibhai Patel (Gurantor)                                       | All the Right, title and interest in Flat No. 105 with super built up area admeasuring 763.00 sq. ft. i.e. 70.91 sq. mtrs., built up are admeasuring 494.00 sq. ft. i.e. 45.95 sq. mtrs. on the 1st floor of residential building named and known as <b>"Shivdarshan Residency"</b> and undivided proportionate share of 13.21 sq. mtrs. In land under the said building standing on land bearing Plot No. 15 admeasuring 185.00 sq. mtrs. & Plot No. 16 admeasuring 185.00sq. mtrs total admeasuring 370.00 sq. mtrs., Revenue Survey No. 102/4 of Vijalpore, Taluka Jaljalsore, District Navsari standing in the name of <b>Mr. Vinaykumar Babubhai Patel</b> and Bounded as follows: East : Plot No. 7/Open Land, West : Common Passage, North : Flat No. 104, South : Plot No. 8/Open Land. | <b>11,84,783.71 + Other Charges &amp; Expenses</b> | <b>7,55,370/- 75,537/-</b>            | Physical             | <b>15.05.2025</b><br><b>Time 10.00 to 12.00</b> |
| 2.      | Anitaben Rajendra Kahar (Borrower Cum Mortgagor)<br>Rajendra Jagdishbhai Kahar (Co-borrower)<br>Rahul Sureshbhai Kahar (Guarantor) | All that piece and parcel of immovable property in the form of House No. 4/1413 with construction admeasuring 590 sq. ft. constructed on Plot No. 32 admeasuring 54.90.58 sq. mtrs. in Ward No. 4 situated on land bearing Tikka No. 15/3, City Survey No. 12 at Dandiwad, near Kahar Wad, Navsari, Taluka and District Navsari standing in the name of <b>Mrs. Anitaben Rajendra Kahar</b> and bounded as follows: East : Kheshtapral Temple, West : Plot No. 31, North : Open Road, South : Open Road.                                                                                                                                                                                                                                                                                        | <b>17,03,146.50 + Other Charges &amp; Expenses</b> | <b>13,50,000/- 1,35,000/-</b>         | Physical             | <b>15.05.2025</b><br><b>Time 10.00 to 12.00</b> |

**Last date of EMD Submisson According to date of Auction is 22-05-2025, Minimum Bid incremental amount Rs. 10,000/- (Rs. Ten thousand only).**  
**Statutory 15 days Sale Notice for under Sarfaesi Act to Borrower / Guarantor / Mortgagor**

For detailed terms and conditions of sale, please refer/visit to the website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal <https://baanknet.com>

**Date : 06-05-2025 | Place : Navsari****Also, prospective bidders may contact the Authorised officer on Mobile - 9328284429****Authorised Officer, Bank of Baroda**



**SAMBHAAV GROUP**

**SAMBHAAV MEDIA LIMITED**  
(CIN: L67120GJ1999PLC014094)  
**Registered Office:** "Sambhaav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015  
**Phone:** + 91 79 2687 3914/15/16/17  
**Email:** [secretarial@sambhaav.com](mailto:secretarial@sambhaav.com) **Website:** [www.sambhaav.com](http://www.sambhaav.com)



Scan to view Financial Results

**EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2025**

| SN |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | Particulars   |           |            |          |           |               |           |            |          |           | Total |  |  |  |
|----|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------|-----------|------------|----------|-----------|---------------|-----------|------------|----------|-----------|-------|--|--|--|
|    |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | Standalone    |           |            |          |           | Consolidated  |           |            |          |           |       |  |  |  |
|    |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | Quarter Ended |           | Year Ended |          |           | Quarter Ended |           | Year Ended |          |           |       |  |  |  |
|    | (Refer Notes below)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        | 31-03-25      | 31-12-24  | 31-03-24   | 31-03-25 | 31-03-24  | 31-03-25      | 31-12-24  | 31-03-24   | 31-03-25 | 31-03-24  |       |  |  |  |
|    |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | Audited       | Unaudited | Audited    | Audited  | Unaudited | Audited       | Unaudited | Audited    | Audited  | Unaudited |       |  |  |  |
| 1  | Total Income from Operations (net)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         | 978.73        | 1,014.01  | 1,254.98   | 3,745.25 | 3,941.66  | 1,088.27      | 1,117.25  | 1,303.76   | 4,187.13 | 3,995.70  |       |  |  |  |
| 2  | Net Profit/ (Loss) for the period before Tax, Exceptional items                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | 19.86         | 126.65    | 196.14     | 212.42   | 105.28    | (6.10)        | 67.47     | 198.46     | 55.79    | 103.78    |       |  |  |  |
| 3  | Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     | 19.86         | 126.65    | 196.14     | 212.42   | 105.28    | (6.10)        | 67.47     | 232.66     | 55.79    | 129.71    |       |  |  |  |
| 4  | Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      | 20.32         | 94.05     | 187.83     | 146.91   | 117.02    | 1.17          | 49.73     | 223.69     | 31.33    | 139.98    |       |  |  |  |
| 5  | Net Profit/(Loss) from discontinued operations after tax                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | (11.97)       | (17.08)   | (3.57)     | (37.28)  | (81.77)   | (11.97)       | (17.08)   | (3.57)     | (37.28)  | (81.77)   |       |  |  |  |
| 6  | Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | 13.89         | 76.57     | 186.93     | 114.26   | 40.29     | (4.42)        | 32.25     | 222.58     | (0.49)   | 63.04     |       |  |  |  |
| 7  | "Equity Share Capital (Face Value of ₹ 1/- per share)"                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     | 1,911.11      | 1,911.11  | 1,911.11   | 1,911.11 | 1,911.11  | 1,911.11      | 1,911.11  | 1,911.11   | 1,911.11 | 1,911.11  |       |  |  |  |
| 8  | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        | -             | -         | -          | 6,452.46 | 6,338.20  | -             | -         | 6,458.92   | 6,414.40 | -         |       |  |  |  |
| 9  | Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             |               |           |            |          |           |               |           |            |          |           |       |  |  |  |
|    | Basic and diluted EPS before Exceptional items (₹) -Continuing operations                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  | 0.01          | 0.05      | 0.10       | 0.08     | 0.06      | 0.00          | 0.03      | 0.10       | 0.02     | 0.06      |       |  |  |  |
|    | Basic and diluted EPS before Exceptional items (₹) -Discontinuing operations                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               | (0.01)        | (0.01)    | (0.00)     | (0.02)   | (0.04)    | (0.01)        | (0.01)    | (0.00)     | (0.02)   | (0.04)    |       |  |  |  |
|    | Basic and diluted EPS after Exceptional items (₹)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          | 0.00          | 0.04      | 0.10       | 0.06     | 0.02      | (0.00)        | 0.03      | 0.12       | 0.02     | 0.03      |       |  |  |  |
| 1. | The above is an extract of the detailed format of Quarterly and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 06, 2025 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at <a href="http://www.bseindia.com">www.bseindia.com</a> and <a href="http://www.nseindia.com">www.nseindia.com</a> and also on the Company's website at <a href="http://www.sambhaav.com">www.sambhaav.com</a> . |               |           |            |          |           |               |           |            |          |           |       |  |  |  |
| 2. | The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |               |           |            |          |           |               |           |            |          |           |       |  |  |  |
| 3. | # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               |               |           |            |          |           |               |           |            |          |           |       |  |  |  |
|    | <b>Place : Ahmedabad</b><br><b>Date : May 06, 2025</b>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |               |           |            |          |           |               |           |            |          |           |       |  |  |  |
|    | <b>For and on behalf of the Board of Directors</b><br><b>Sd/-</b><br><b>Manoj B Vadodaria</b><br><b>Managing Director</b><br><b>DIN: 00092053</b>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |               |           |            |          |           |               |           |            |          |           |       |  |  |  |



**PUBLIC NOTICE**

That our Client has demanded for the title clearance certificate of the Non-agricultural plot of Land in Moje Vagra, lying being land bearing Revenue Survey No 6, "UVESH PARK" paikki Plot No 48, New Block/Survey No 1986, Plot area admeasuring 61.88 Sq. Mtrs., Built up area admeasuring 41.82 Sq. Mtrs., at Registration District & Sub-District Vagra & District Bhuruch. That the captioned property is presently owned by 1. Diwan Riyaj Rustamsha 2. Divan Aarjaban Riyaj. They have been informed us that the Sale Deed executed by Mahamad Yusuf Umarji in favour of Jufikar Ismail Patel before the Sub-Registrar Vagra vide Registration no. 1642 Dated 20.04.2012. THEREAFTER Sale Deed was executed by Jufikar Ismail Patel in favour of Pravinchandra Kesanichand & Co. a Partnership Firm through its Partner Tushar Pravinchandra Shah before the Sub Registrar-Vagra Vides Registration no. 1821 dated 25.04.2013. That the above mention deeds Original Registration Receipts and Sale Deeds are Missing. Therefore if any individual/ Bank or any Financial Institution has its charge or lien on the said above captioned Property, then within 7 days from the publication of the notice may send their objections along with the Supporting Evidence. If not send within given period then my client will initiate further proceedings.

**TEREDESAI ASSOCIATES**  
SAPAN TEREDESAI (ADVOCATE) | PAVAL TEREDESAI (ADVOCATE) | NIRAJ THAKKAR (ADVOCATE)  
407/408, 4th Floor, Bluechip Complex, Nr. Stock Exchange, Sarvagijung, Sarvagijung, Vadodra-5 Mo.-721101322



**DEBTS RECOVERY TRIBUNAL-II**  
(Ministry of Finance, Government of India)  
3rd Floor, Bhikhubhai Chamber 18, Gandhi Kunj Society, Opp. Deepak Petrol Pump, Ellisbridge, AHMEDABAD-380006.

**Outward No. 701/2025**

O.A. 516/2023  
BANK OF MAHARASHTRA  
SILVERSUN SANITARYWARE LLP & ORS

VERSUS  
APPLICANT  
DEFENDANT

Exb.No. A/08

To,

(1) SILVERSUN SANITARYWARE LLP, REGD OFFICE. FLAT NO. 604 -BHAGWATI TOWER, RAVAPAR, VILLAGE -MORBI -363641, GUJARAT, ADDRESS:- REVENUE SURVEY NO.88 PAIKI 1 PAIKI 1, ANIYARI CHOKADI, MALIYA HALVAD HIGHWAY, VILLAGE RAPAR, MORBI -363630

(2) KAILASHBHAI DAYABHAI MERJA, ADDRESS:- 247 BHARATINAGAR 1 TO 5, BHARTINAGAR, MEENAXI NAGAR, SHIYANI NAGAR, RAJKOT - 360002

(3) NITINBHAI VASHRAMBHAI SHANGHANI ADDRESS: AT GHUNTU, MORBI -363641

(4) RAVI HARESHBHAI KAILA, ADDRESS: AT GHUNTU, MORBI -363641

(5) DIVYESH HARJIVANBHAI KAILA, ADDRESS: AT GHUNTU, MORBI -363641

(6) DARSHANKUMAR RAMESHBHAI KAILA, ADDRESS: AT GHUNTU, MORBI -363641

(7) BRIJESH KAMLESHBHAI RAVAL, ADDRESS:- FLAT NO. 601 -LABHLAXMI APARTMENT, NAVA BUS STAND, SVASTIK CO. OPP. SOCIETY, SHANALA ROAD, MORBI-363641

(8) YURVAJ DINESHBHAI BAVARVA, ADDRESS: BLOCK NO. 887-GUJARAT HOUSING BOARD, SHANALAROAD, MORBI-363641

(9) RAJESHBHAI MANSUKHBHAI SHERASIYA ADDRESS: NEAR RAMJI TEMPLE, RAVAPAR, MORBI-363641

(10) SATISHBHAI PRABHULAL DETROJA ADDRESS: AT KALYANPUR, TANKARA -363650

(11) ASHOKBHAI DAYABHAI MERJA, ADDRESS:- BAHUCHAR NIVAS, BHARTINGAR STREET NO.4, NEAR NANDA HALL, KOTHARIYA, MAIN ROAD, RAJKOT -360002

(12) CHHAGANBHAI BHANJIBHAI MAKASANA ADDRESS:- 103 -SHRIJI APARTMENT, KRISHNA NAGAR SOCIETY 2, KAMREJ, SURAT, KAMREJ CHAR RASTA, SURAT -394185

(13) LATABEN KAILASHBHAI MERJA ADDRESS: AMRUT PARK, NEAR GOPAL SOCIETY, MORBI-363642

(14) TEJASVI KAILASHBHAI MERJA ADDRESS: AMRUT PARK, NEAR GOPAL SOCIETY, MORBI-363642

(15) NISHITA KAILASHBHAI MERJA ADDRESS:- AMRUT PARK, NEAR GOPAL SOCIETY, MORBI-363642

(16) PRAFULLABEN DARSHANKUMAR KAILA ADDRESS:- AT GHUNTU, MORBI -363641

(17) DEVARAJ CHHAGANBHAI MAKASANA ADDRESS:- 103 SHREEJI APARTMENT, KRISHNA NAGAR SOCIETY 2, KAMREJ, CHAR RASTA, KAMREJ, SURAT -394185

(18) AVCHARBHAI SAVJIBHAI MAKASANA ADDRESS:- AT BELA RANGPAR, MORBI -363641

(19) REKHABEN DEVARAJBHAI MAKASANA ADDRESS:- 103 KRUSHNANAGAR 2, NEAR FECIPI HOTEL, KAMREJ 7, KAMREJ, SURAT -394180

(20) PRITIBEN PRAKASHBHAI HULANI ADDRESS: HARI OM PARK, GHUNTU, MORBI -363641

WHEREAS the above named applicant has filed the above referred application in this Tribunal.

1. WHEREAS the service of Summons/Notice could not be effected in the ordinary manner and whereas the application for substituted service has been allowed by this Tribunal.

2. Defendant are hereby directed to show cause as to why the Original Application Should not be allowed.

3. You are directed to appear before this Tribunal in person or through an Advocate on 16/06/2025 at 10.30 a.m. and file the written statement / Reply with a copy thereof furnished to the applicant upon receipt of the notice.

4. Take notice that in case of default, the Application shall be heard and decided in your absence.

GIVEN UNDER MY HAND AND SEAL OF THE TRIBUNAL ON THIS 07/04/2025.

PREPARED BY  
M.

CHECKED BY

Seal

SECTION OFFICER



**HDFC BANK**

**HDFC Bank Ltd.**

**Branch Address: 201 - 204, Riddhi Shoppers, Opp. Imperial Square, Adajan - Hazira Road, Surat - 395009.**

**POSSESSION NOTICE**

Whereas the Authorised Officer/s of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023), (HDFC) under Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc till the date of payment and /or realization.

| Sr. No. | Name Of Borrower (S) / Legal Heir(S) And Legal Representative(S)                                                                                                                                                                                                                                                                                                         | Outstanding Dues (Rs.)                                                       | Date Of Demand Notice | Date Of Possession Physical/ Symbolic | Description Of Immovable Property (ies) / Secured Asset (S)                                                                                                                          |
|---------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------|-----------------------|---------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| (a)     | (b)                                                                                                                                                                                                                                                                                                                                                                      | (c)                                                                          | (d)                   | (e)                                   | (f)                                                                                                                                                                                  |
| 1       | MR. RAJKUMAR RANCHANDRA MAHESHWARI (BORROWER) MRS. KIRANDEVI RAJKUMAR MAHESHWARI (CO-BORROWER)<br><br>180915 - 636167606 and 638590783                                                                                                                                                                                                                                   | Rs.24,29,084/- and Rs.2,39,576/- respectively as on 31 July, 2024*           | 11 Sep., 2024         | 04 May, 2025 PHYSICAL                 | FLAT – A-502, 5TH FLOOR, MAA ANANDI HEIGHTS – B, No. 2, 3, 5, R.S. No. 2/1, 2/2, 2/4, DAKKHAHWADA VILLAGE, DEVADHI- DELAVADA ROAD, NR. MAA ANANDI BUNGLOWS, SURAT – 395010.          |
| 2       | MR. AJITBHAI VITHALRAY SONAR (BORROWER) MRS. PRITIBEN AJITBHAI SONI (CO-BORROWER)<br><br>177199 - 636209324 and 632287977                                                                                                                                                                                                                                                | Rs.14,67,822/- and Rs.1,46,709/- respectively as on 31 Aug., 2024*           | 7 Oct., 2024          | 04 May, 2025 PHYSICAL                 | FLAT – A/8 – 101, 1ST FLOOR, SHYAM VATIKA – A/7, A/8, A/9, S.No. 289, BLOCK 374, B/H GHANSHYAM PARK, NR. MAA KRUPA, NR. YASHODA NANDA, NR. AMBIKA - DELVADA VILLAGE, SURAT – 394210. |
| 3       | Son/ Daughter/ Husband of MRS. ANJUBEN SHARMA [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MRS. ANJUBEN SHARMA [Since Deceased] MR. MANOJKUMAR KAPIL HAJAM (BORROWER) MR. PANKAJ KUMAR SHARMA (CO-BORROWER) MR. ROHIT THAKUR (CO-BORROWER) MRS. ANJUBEN SHARMA (CO-BORROWER)<br><br>182207- 6329257537 | Rs.86,944/- and Rs.25,27,750/- respectively as on 31 Aug., 2024*             | 27 Sep., 2024         | 04 May, 2025 PHYSICAL                 | ROW HOUSE – 133, GOKULDHAM SAI PALACE, S. No. 173/1, BLOCK - 190/2, B/H GOMANSINH ROW HOUSE, OPP. LAKE, SANIYA - BHESTAN ROAD, SANIYA - KANDE, DINDOLI, SURAT – 394210.              |
| 4       | MR. PRUTHIVIRAJ SINH BALUBHAI RATHOD (BORROWER)<br><br>181444 - 635119513, 292046139 and 633903704                                                                                                                                                                                                                                                                       | Rs.22,000/-, Rs.6,66,600/- and Rs.28,006/- respectively as on 31 July, 2024* | 11 Sep., 2024         | 04 May, 2025 PHYSICAL                 | ROW HOUSE – 996, RAMI PARK, S. No. 4, 5, 6, 7, BLOCK 14, NR. AMBIKA PARK, OPP. MAHADEV NAGAR - 4, DINDOLI, SURAT – 394210.                                                           |

\* with further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation.

However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officer/s of HDFC (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) have taken possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/ them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property (ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC Bank Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets/.

Copies of the Panchnama drawn and Inventory made are available to the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

**For HDFC Bank Ltd.**  
**Sd/-**  
**Authorised Officer**

**Date: 06-05-2025**  
**Place : Surat**

**Regd. Office : HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013.**  
**CIN : L65920MH1994PLC080618, Website : [www.hdfcbank.com](http://www.hdfcbank.com)**



**RELIGARE FINVEST LIMITED**

**CIN:U74999DL1995PLC064132**  
**Registered Office:** 1407, 14th Floor, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi 110019  
**Corporate Office:** Max House, 7th Floor, Block A, Dr. Jha Marg, Okhla Phase-III, Okhla Industrial Estate, New Delhi 110020  
**Branch Office:** 1006-1007, 10th Floor, Shivalki Ship, Iscon Cross Road, S. G. Highway, Ahmedabad -



સેન્સેક્સ કંપનીઓમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, NTPC, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેંક અને સન ફાર્મા મુખ્ય ઘટ્યા

# ભારત-પાક. તણાવથી રોકાણકારો સાવધ : શેરબજાર નીચા સ્તરે બંધ

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૪૯૭.૭૯ કરોડ રૂપિયાના ઇક્વિટી ખરીદ્યા: વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્લેન્ડ ફૂડ ૨.૭૬ ટકા વધીને USD ૬૧.૮૫ પ્રતિ બેરલ પર પહોંચી ગયું

મુંબઈ,તા.૬ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રોકાણકારોએ ખાસ કરીને બેંકિંગ અને ઓઈલ શેરોમાં નફાની ભુકિંગને કારણે મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી રેન્જ-બાઉન્ડ ટ્રેડમાં નીચા સ્તરે બંધ થયા હતા. બે દિવસના વધારાને અટકાવતા, ૩૦ શેરો ધરાવતો **BSE** સેન્સેક્સ ૧૫૫.૭૭ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા ઘટીને ૮૦,૬૪૧.૦૭ પર સ્થિર થયો. દિવસ દરમિયાન, તે ૩૧૫.૮૧ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા ઘટીને ૮૦,૪૮૧.૦૩ પર બંધ થયો. **NSE** નિફ્ટી ૮૧.૫૫ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા ઘટીને ૨૪,૩૭૯.૬૦ પર બંધ થયો.

યુએસ ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણય અને યુએસ-ચીન વેપાર વાટાઘાટો અંગેની ચિંતાઓ પહેલાં ટ્રેડિંગ પ્રવૃત્તિ શ્રેણીબદ્ધ હતી, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે. પરમાણુ પ્લાન્ટ, લશ્કરી થાણા, રિફાઈનરીઓ અને હાઈડ્રોઈલેક્ટ્રિક ડેમ જેવા સંવેદનશીલ સ્થાપનો ધરાવતા લગભગ ૩૦૦ 'નાગરિક સંરક્ષણ જિલ્લાઓ'માં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન, પ્રતિકૂળ હુમલા માટે

નાગરિક તાલીમ અને બંકરો અને ખાઈઓની સફાઈ પર મોક ડ્રીલ યોજાશે. સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલ, ટાટા મોટર્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, **NTPC**, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેંક અને સન ફાર્મા મુખ્ય ઘટ્યા હતા. ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા અને મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે અને મારુતિ વધ્યા હતા. એશિયન બજારોમાં, શાંધાઈનો જીજીઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઊંચો સ્થિર થયો હતો. દક્ષિણ કોરિયન અને જાપાની બજારો રજાઓને કારણે બંધ હતા.

ભારત-પાકિસ્તાન સરહદી તણાવ વચ્ચે સાવચેતીભર્યા ભાવનાને કારણે મજબૂત રિકવરી પછી તાજેતરના સત્રોમાં સ્થાનિક બજાર મજબૂત થઈ રહ્યું છે. વર્તમાન ક્વાર્ટરમાં નબળા કમાણી વૃદ્ધિએ બજારને વધુ અસર કરી છે. દરમિયાન, રોકાણકારો અમેરિકા સાથે ભારતની દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો પર નજીકથી નજર રાખી રહ્યા છે. વધુમાં, યુએસ ફેડરલ રિઝર્વની આસપાસની અટકળો ધ્યાન ખેંચી રહી છે, કારણ કે નજીકના ભવિષ્યમાં કોઈ દર ઘટાડાની અપેક્ષા નથી, જે વૈશ્વિક વલણોને અસર કરે છે, જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું.

મંગળવારે થયેલા માસિક સર્વે મુજબ, એપ્રિલમાં ભારતના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં થોડો વધારો થયો હતો, જે મુખ્યત્વે નવા ઓર્ડર પ્રવાહમાં ઝડપી વધારાને કારણે હતો, જેના કારણે રોજગારમાં ઝડપી વિસ્તરણ પણ થયું હતું. સીઝનલી એડજસ્ટેડ **HSBC** ઈન્ડિયા સર્વિસીસ **PMI** બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ એપ્રિલમાં ૫૮.૭ પર પહોંચ્યો, જે માર્ચમાં ૫૮.૫ હતો, જે સર્વિસ સેક્ટરના ઉત્પાદનમાં તીવ્ર અને મજબૂત વિસ્તરણ સૂચવે છે. સોમવારે ૩૦ શેરો ધરાવતો **BSE** બેન્ચમાર્ક ૨૯૪.૮૫ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા વધીને ૮૦,૭૯૬.૮૪ પર સ્થિર થયો. નિફ્ટી ૧૧૪.૪૫

## ઔદ્યોગિક ક્ષેત્રોમાં ડીઝલનો વ્યાપક ઉપયોગ પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશમાં વધારો એ ભારતના મજબૂત આર્થિક પાયાનો મુખ્ય સૂચક



નવી દિલ્હી,તા.૬ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે હેડગાના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ ના ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં કૃષિ, બીજાસ્ટિક્સ, ઉડ્ડયન અને વીજળી જેવા મહત્વપૂર્ણ આર્થિક ક્ષેત્રો દ્વારા બળતણનો મજબૂત વપરાશ વિસ્તરણના સંકેત તરફ નિર્દેશ કરે છે. ડેટા અનુસાર, એપ્રિલમાં ડીઝલનો વપરાશ વધીને ૮.૨૪ મિલિયન ટન થયો હતો, જે એક મહિનામાં બીજા ક્રમનો સૌથી વધુ વપરાશ હતો, જ્યારે મે ૨૦૨૪ માં તેનો વપરાશ ૮.૪૧ મેટ્રિક ટનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

## એકિઝક્યુટિવ ડિરેક્ટર સુબ્રમણ્યમની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય: આઈએમએફ

નવી દિલ્હી,તા.૬ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું હતું કે એકિઝક્યુટિવ ડિરેક્ટર કેવી સુબ્રમણ્યમની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. ભારત સરકારે સુબ્રમણ્યમને તેમના ત્રણ વર્ષના કાર્યકાળના છ મહિના પહેલા જ સમાપ્ત કરી દીધા છે. આ સમાપ્તિ ૩૦ એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવી હતી. જોકે, સુબ્રમણ્યમના રાજીનામાના કારણોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એકિઝક્યુટિવ બોર્ડના કોઈપણ સભ્યની નિમણૂક અને સમાપ્તિ એ સભ્ય દેશોનો નિર્ણય છે. ઈડી સુબ્રમણ્યમની સમાપ્તિ એ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય છે. અમે તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને તેમના અનુગામી સાથે કામ કરવા આતુર છીએ, ટિપ્પણીઓ માટે સંપર્ક કરવામાં આવતાં સ્પષ્ટ પ્રવક્તાએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના નવીનતમ પુસ્તક, **'India@100: Envisioning Tomorrow's Economic Powerhouse'** ના પ્રમોશન અને પ્રચાર સંબંધિત કથિત અયોગ્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે સુબ્રમણ્યમ તેમના સત્તાવાર પદનો ઉપયોગ કરીને કેટલીક સંસ્થાઓ પર તેમનું પુસ્તક ખરીદવા માટે દબાણ કર્યું હતું.

## અનિયંત્રિત એન્ટિટી માટે લઘુત્તમ ટિકિટ કદ અથવા રોકાણ મર્યાદા રૂ. ૧ કરોડ ફરજિયાત કરી સેબીએ સિક્યોરિટીઝ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને સિક્યોરિટી રિસિપ્ટ્સ ઈશ્યૂ અને લિસ્ટિંગ નિયમોમાં સુધારો કર્યો સેબીએ ઓરિજિનેટર્સ માટે ન્યૂનતમ ટ્રેક રેકોર્ડની જરૂરિયાત નક્કી કરી : ત્રણ વર્ષનો ઓપરેટિંગ અનુભવ જરૂરી

નવી દિલ્હી,તા.૬ બજાર નિયમનકાર સેબીએ **RBI** દ્વારા નિયંત્રિત મૂળ અને સિક્યોરિટીઝ ઝેર પ્રવૃત્તિઓમાં રોકાયેલા અનિયંત્રિત એન્ટિટી માટે લઘુત્તમ ટિકિટ કદ અથવા રોકાણ મર્યાદા રૂ. ૧ કરોડ ફરજિયાત કરી છે. સિક્યોરાઈઝ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એ વિવિધ પ્રકારના દેવા - જેમ કે લોન, મોર્ટગેજ અથવા રીસીવેબલ - ને એકસાથે ભેગા કરીને અને પછી તેને રોકાણકારોને સિક્યોરિટીઝ તરીકે વેચીને બનાવવામાં આવતી નાણાકીય પ્રોડક્ટ્સ છે. આ પ્રક્રિયા, જેને સિક્યોરિટાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે, તે પ્રણેતા ને અપ્રવાહી સંપત્તિઓને પ્રવાહી સંપત્તિમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે, જે ભંડોળનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડે છે. આ સાધનોમાં રોકાણકારોને અંતર્ગત દેવાના પૂલના પ્રદર્શનના આધારે વળતર



મળે છે, અને જોખમ બહુવિધ સંપત્તિઓમાં ફેલાયેલું છે, જે સંભવિત આકર્ષક વળતર આપે છે. સિક્યોરાઈઝ દેવાના સાધનના ઈશ્યૂ માટે લઘુત્તમ ટિકિટનું કદ રૂપિયા એક કરોડ હોવું જોઈએ, સેબીએ એક ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું. વધુમાં, સિક્યોરાઈઝ ડેટ

ઈન્સ્ટ્રુમેન્ટના અનુગામી ટ્રાન્સફર માટે ન્યૂનતમ ટિકિટ કદ મૂળકર્તાઓ માટે રૂ. ૧ કરોડ હશે, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત નથી. લિસ્ટેડ સિક્યોરિટીઝ સાથે સિક્યોરાઈઝ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ માટે, ન્યૂનતમ ટિકિટ કદની રકમ આવી સિક્યોરિટીઝમાં સૌથી વધુ ફેસ વેલ્યુ હશે.

નવા નિયમોમાં **SDI** માટે જાહેર ઓફર ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ દસ દિવસ માટે ખુલ્લી રાખવાની જોગવાઈ હતી, જેમાં જાહેરાતની આવશ્યકતાઓ નોન-કન્વર્ટેબલ સિક્યોરિટીઝ માટેના સેબીના નિયમો સાથે સુસંગત હતી. વધુમાં, નિયમનકારે જણાવ્યું હતું કે તમામ સિક્યોરાઈઝ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ફક્ત ડીમેટ સ્વરૂપમાં જારી અને ટ્રાન્સફર કરવા જોઈએ. સેબીએ ઓરિજિનેટર્સ માટે ન્યૂનતમ ટ્રેક રેકોર્ડની જરૂરિયાત નક્કી કરી છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ઓપરેટિંગ અનુભવ જરૂરી છે. જોખમ વ્યવસ્થાપન અંગે, સેબીએ જણાવ્યું હતું કે ઓરિજિનેટર્સ સિક્યોરાઈઝ પૂલના ૧૦ ટકા અથવા ૨૪ મહિના સુધીની પાકની મુદત સાથે પ્રાપ્તિપાત્ર માટે ૫ ટકાનું ન્યૂનતમ જોખમ જાળવી રાખશે. સમયગાળો અને બે વધેથી વધુ મુદત ધરાવતી લોનના કિસ્સામાં છ મહિનાનો નિર્દિષ્ટ કર્યો છે.

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં વધારો

માલ પરિવહનમાં, માંગમાં વધારો થવાથી રેકમાં વધારો થયો છે. એપ્રિલમાં પેટ્રોલનો સૌથી વધુ વપરાશ પાછલા વર્ષો કરતાં ૪.૬ ટકા વધીને લગભગ ૩.૪૪ મિલિયન ટન થયો, કારણ કે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હતો. ૨૦૨૪માં વધારો મુખ્યત્વે ચૂંટણીને કારણે થયો હતો, પરંતુ આ વર્ષે વપરાશમાં વધારો સ્થિર આર્થિક પ્રવૃત્તિઓ અને ઓટોમોબાઈલના વેચાણમાં વધારો દર્શાવે છે. **LPG**નો વપરાશ પણ ૬.૭ ટકા વધીને ૨.૬૨ મિલિયન ટન થયો. વિશ્લેષકોનું માનવું છે કે આ વધારો ઘરેલુ અને વ્યાપારી બંને પરિબળોને કારણે થયો છે.

## સોનું ૧,૪૭૯ વધીને ૯૬,૭૬૧ પર પહોંચ્યું આ વર્ષે અત્યાર સુધીમાં ૨૦,૫૯૯ રૂપિયા મોંઘુ થયું, વર્ષના અંત સુધીમાં રૂ. ૧.૧૦ લાખ સુધી પહોંચી શકે

નવી દિલ્હી,તા.૬ આજે એટલે કે ૬ મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૧,૪૭૯ વધીને ૯૬,૭૬૧ થયો છે. અગાઉ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૯૫,૨૮૨ હતો. તે જ સમયે આજે એક કિલો ચાંદીનો ભાવ ૧,૭૪૫ થયો છે, ૯૫,૨૪૫ પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ૯૪,૧૦૦ પ્રતિ કિલો હતો. આ પહેલા ૨૧ એપ્રિલે સોનાનો ભાવ ૯૯,૧૦૦ની ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો.



ગ્રામનો ભાવ ૯૮,૪૬૦ રૂપિયા છે.કોલકાતામાં ૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૯૦,૨૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૯૮,૪૬૦ રૂપિયા છે.ચેન્નાઈમાં ૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૯૦,૨૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૯૮,૪૬૦ રૂપિયા છે.ભોપાલમાં ૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૯૦,૩૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૯૮,૫૧૦ રૂપિયા છે.છેલ્લા ૧૧ દિવસમાં સોનાના ભાવમાં તેના ઓલ ટાઈમ હાઈ સ્તરથી ૫,૩૬૬ રૂપિયાનો ઘટાડો થયો છે.

અપ્રિલમાં વ્યાપારિક પ્રવૃત્તિઓમાં વધારો, સેવા ક્ષેત્ર મજબૂત બન્યું

નવી દિલ્હી,તા.૬ એપ્રિલમાં ભારતની વ્યાપારિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ જોવા મળી છે. એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ એપ્રિલમાં ૫૮.૭ થયો, હતો જે માર્ચમાં ૫૮.૫ હતો. આ સેવા ક્ષેત્રમાં ઝડપી અને મજબૂત વિસ્તરણ સૂચવે છે. નાણાકીય વર્ષ ૨૬ ની શરૂઆતમાં ઈનપુટ કિંમતોમાં નજીવો વધારો થયો હતો અને છ મહિનામાં સૌથી ધીમી ગતિએ વધારો થયો છે.ઉત્પાદનમાં વધારો નવા વ્યવસાયમાં વૃદ્ધિને કારણે થયો હતો, જે આઠ મહિનામાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ હતો. સર્વેમાં ઘણી કંપનીઓએ અનુકૂળ માંગની સ્થિતિ અને સફળ માર્કેટિંગનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક કિસ્સાઓમાં, કાર્યક્ષમતામાં વધારો થવાથી કંપનીઓ વધુ કામ કરી શકી હોવાનું કહેવાય છે. અગાઉના સર્વેક્ષણોના વલણોને અનુરૂપ, ફાઈનાન્સ અને વીમા પેટા-ક્ષેત્રે ઉત્પાદન અને નવા ઓર્ડર બંને માટે સૌથી વધુ વૃદ્ધિ દર હાંસલ કર્યો.

## પેસેન્જર વાહનોના બહુ ઓછા નવા મોડેલ લોન્ચ થયા એપ્રિલમાં કારનું વેચાણ ધીમું રહ્યું કુલ છૂટક વેચાણમાં ૩%નો વધારો ડિસ્કાઉન્ટ આધારિત બજાર અને ઊંચી ઇન્વેન્ટરી તરફ નિર્દેશ કરે છે

નવી દિલ્હી,તા.૬ દેશમાં લોકો હવે ઓછા વાહનો ખરીદી રહ્યા છે, ઓછામાં ઓછું હ્રોટ્ઝ ના આંકડા આ જ કહી રહ્યા છે. **FADA** એ એપ્રિલ મહિનાના આંકડા જાહેર કર્યા છે, જે દર્શાવે છે કે માર્ચથી શરૂ થયેલી મંદી આગામી મહિનામાં પણ ચાલુ રહી. જ્યારે આ પહેલા ફેબ્રુઆરીમાં ૧૩% નો જબરદસ્ત વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. **FADA** મુજબ, એપ્રિલ ૨૦૨૫ માં વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે માત્ર ૩% નો વધારો થયો હતો, જ્યારે માર્ચમાં પણ તે લગભગ ૩.૧૪% હતો. એપ્રિલમાં,

ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે ૨.૨૫% વધીને ૧૬,૮૬,૭૭૪ યુનિટ થયું, જ્યારે માસિક વૃદ્ધિ ૧.૧૮% રહી. વાર્ષિક ધોરણે, થ્રી-વ્હીલરનું વેચાણ ૨૪.૫૧% વધીને ૯૯,૭૬૬ યુનિટ થયું, જ્યારે માસિક વૃદ્ધિ માત્ર ૦.૩૯% હતી. માસિક ધોરણે, પેસેન્જર વાહનોના વેચાણમાં ૦.૧૯% નો નજીવો ઘટાડો થયો હતો, પરંતુ વાર્ષિક ધોરણે તે ૧.૫૫% વધીને ૩,૪૮,૯૩૯ યુનિટ થયું હતું. વાણિજ્યિક વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૧.૦૫% ઘટીને ૯૦,૫૫૮ યુનિટ થયું હતું, પરંતુ માસિક ધોરણે તેમાં ૪.૪૪%નો ઘટાડો થયો

હતો. એપ્રિલમાં વાહનોનું કુલ છૂટક વેચાણ વાર્ષિક ધોરણે ૨.૯૫% વધીને ૨૨,૮૭,૯૫૨ યુનિટ થયું, જ્યારે માસિક વેચાણ વૃદ્ધિ ૭.૫૭% રહી. એપ્રિલ મહિનામાં, બજારમાં પેસેન્જર વાહનોના બહુ ઓછા નવા મોડેલ લોન્ચ થયા હતા, છતાં તેની ૧.૫૫% ની વેચાણ વૃદ્ધિ યોગ્ય ગણી શકાય. આ ડિસ્કાઉન્ટ આધારિત બજાર અને ઊંચી ઇન્વેન્ટરી તરફ નિર્દેશ કરે છે, જે લગભગ ૫૦ દિવસની છે. જ્યારે બજારનો પ્રતિભાવ વધતા ખર્ચને આવરી લેવા માટે ડીલરશીપ પર ૨૧ દિવસની ઇન્વેન્ટરી વિશે વાત કરે છે.

| SAMBHAHV MEDIA LIMITED                                                                                             |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
|--------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------|------------|----------|---------------|------------|----------|----------|----------|----------|----------|
| (CIN: L67120GJ1990PLC014094)                                                                                       |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
| Registered Office: "Sambhaav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015   |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
| Phone: +91 79 2687 3914/15/16/17                                                                                   |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
| Email: secretarial@sambhaav.com Website: www.sambhaav.com                                                          |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
| EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2025 |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
| (₹ in Lakhs)                                                                                                       |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |               |            |          |               |            |          |          |          |          |          |
| SN                                                                                                                 | Particulars                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             | Standalone    |            |          | Consolidated  |            |          | 31-03-24 | 31-03-25 | 31-03-24 | 31-03-25 |
|                                                                                                                    |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         | Quarter Ended | Year Ended |          | Quarter Ended | Year Ended |          |          |          |          |          |
|                                                                                                                    | (Refer Notes below)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     | Audited       | Audited    |          | Audited       | Audited    |          |          |          |          |          |
| 1                                                                                                                  | Total Income from Operations (net)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      | 978.73        | 1,014.01   | 1,254.98 | 3,745.25      | 3,941.66   | 1,088.27 | 1,117.25 | 1,303.76 | 4,187.13 | 3,995.70 |
| 2                                                                                                                  | Net Profit/(Loss) for the period (before Tax, Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        | 19.86         | 126.65     | 196.14   | 212.42        | 105.28     | (6.10)   | 67.47    | 198.46   | 55.79    | 103.78   |
| 3                                                                                                                  | Net Profit/(Loss) for the period before tax (after Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | 19.86         | 126.65     | 196.14   | 212.42        | 105.28     | (6.10)   | 67.47    | 232.66   | 55.79    | 129.71   |
| 4                                                                                                                  | Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    | 20.32         | 94.05      | 187.83   | 146.91        | 117.02     | 1.17     | 49.73    | 232.69   | 31.33    | 139.98   |
| 5                                                                                                                  | Net Profit/(Loss) from discontinued operations after tax                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | (11.97)       | (17.08)    | (3.57)   | (37.28)       | (81.77)    | (11.97)  | (17.08)  | (3.57)   | (37.28)  | (81.77)  |
| 6                                                                                                                  | Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               | 13.89         | 76.57      | 186.93   | 114.26        | 40.29      | (4.42)   | 32.25    | 222.58   | (0.49)   | 63.04    |
| 7                                                                                                                  | "Equity Share Capital" (Face Value of ₹ 1/- per share)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  | 1,911.11      | 1,911.11   | 1,911.11 | 1,911.11      | 1,911.11   | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 |
| 8                                                                                                                  | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     | -             | -          | -        | 6,452.46      | 6,338.20   | -        | -        | -        | 6,458.92 | 6,414.40 |
| 9                                                                                                                  | Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |               |            |          |               |            |          |          |          |          |          |
|                                                                                                                    | Basic and diluted EPS before Exceptional items (₹) - Continuing operations                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              | 0.01          | 0.05       | 0.10     | 0.08          | 0.06       | 0.00     | 0.03     | 0.10     | 0.02     | 0.06     |
|                                                                                                                    | Basic and diluted EPS before Exceptional items (₹) - Discontinuing operations                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           | (0.01)        | (0.01)     | (0.00)   | (0.02)        | (0.04)     | (0.01)   | (0.01)   | (0.00)   | (0.02)   | (0.04)   |
|                                                                                                                    | Basic and diluted EPS after Exceptional items (₹)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       | 0.00          | 0.04       | 0.10     | 0.06          | 0.02       | (0.00)   | 0.03     | 0.12     | 0.02     | 0.03     |
| 1.                                                                                                                 | The above is an extract of the detailed format of Quarterly and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 06, 2025 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.sambhaav.com. |               |            |          |               |            |          |          |          |          |          |
| 2.                                                                                                                 | The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to changes in accounting policies shall be disclosed by means of a footnote.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |               |            |          |               |            |          |          |          |          |          |
| 3.                                                                                                                 | # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |               |            |          |               |            |          |          |          |          |          |
|                                                                                                                    | Place : Ahmedabad<br>Date : May 06, 2025                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                |               |            |          |               |            |          |          |          |          |          |
|                                                                                                                    | For and on behalf of the Board of Directors<br>Sd/-<br>Manoj B Vadodaria<br>Managing Director<br>DIN: 00092053                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |               |            |          |               |            |          |          |          |          |          |